



TRANS INDIA HOUSE IMPEX LIMITED

(Formerly known as IO System Limited)

CIN: L74110GJ1987PLC152434

Registered Office: B-1101, Titanium Square, B/H. Sarveshwar Tower, OPP. B.M.W. Show Room,
Thaltej, Ahmedabad – 380 054, Gujarat, INDIA

Email: compliance@tihil.co.in; Tel +91-79-46008108 Website: www.tihil.co.in

15th August 2025

To
The Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeebhoy Tower
Dalal Street, Mumbai – 400 001

Ref: TRANS INDIA HOUSE IMPEX LIMITED
SCRIP ID: TIHIL

BSE SCRIP CODE: 523752

SUB: SUBMISSION OF NEWSPAPER PUBLICATIONS OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER ENDED 30TH JUNE 2025.

Dear Sir,

Pursuant to Regulations 30 and 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015, we are enclosing herewith newspaper clippings of the extracts of Un-Audited Standalone Financial Results for the Quarter and ended 30th June, 2025 published on 15th August 2025 in Business Standard (English Newspaper) and Jaihind (Vernacular Newspaper).

You are requested to kindly take the note of the above.

Thanking you,

For Trans India House Impex Limited



Mrugesh Ashwin Kumar Vyas
Company Secretary and Compliance Officer
Membership No. – ACS 49190

Enclosed: A/a

બંગાળની ખાડીમાં લો-પ્રેસર તથા અન્ય સિસ્ટમથી ચોમાસુ વધુ ‘તીવ્ર’ બન્યુ

હિમાચલમાં ફરી પાંચ સ્થળોએ વાદળ ફાટયા; ડઝન રાજ્યોમાં ભારે વરસાદ

નવી દિલ્હી તા.૧૪ બિહાર, દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ દેશમાં હિમાચલથી મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આફતનો સુધી ચોમાસાના વરસાદનુ જોર વધ્યુ વરસાદ રહ્યો હતો.

લખનઉમાં વિધાનસભા ભવનમાં પાણી ધુસ્યા: માર્ગો પર બે-ત્રણ ફુટ પાણી

ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદી રેલમછેલ રહી છે. લખનઉમાં પણ ભારે વરસાદ ઝાટકતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. માર્ગો પર ગોઠણુડળ પાણી ભરાતા ટ્રાફીક અવરોધાચો હતો. અનેક વિસ્તારોમાં મકાનોમાં પણ પાણી ધુસી જતા લોકોએ આખી રાત જાગીને પાણી ઉલેચવુ પડ્યુ હતું. મહત્વની વાત એ છે કે વિધાનસભા ભવનમાં પણ પાણી ધુસી ગયુ હતું. કમંચારીઓને પાણી ઉલેચવા રોકવામાં આલ્યા હતા. વરસાદી હરનેરે પગલે તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનુ બહેર કરાયુ હતુ.

લોચ તેમ અનેક રાજ્યોમાં ભારે બંગાળની ખાડીમાં ઉદભવેલા વરસાદ ખાબકયો હતો. હિમાચલમાં લો-પ્રેસર તથા સંલગ્ન સિસ્ટમથી ફરી પાંચ સ્થળોએ વાદળ ફાટતા દેશના અનેક રાજ્યોમાં વરસાદી જોર તારાજી સર્જાઈ હતી. ઉત્તરપ્રદેશ, વધી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી

મેઘકહેરનો સામનો કરી રહેલા હિમાચલપ્રદેશમાં ફરી વખત પાંચ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. શ્રીખંડના ભીમડવારી તથા નંતી, કિન્નોરના પૂલ, લાહોલના મયાડ તથા કુલ્થુમાં તીર્થન પાર્ટીમાં વાદળ ફાટવાના બનાવ બન્યા હતા તેને પગલે કેટલાંક ભાગોમાં પૂર પરીસ્થિતિ સર્જવા સાથે વ્યાપક નુકશાન થયુ હતું. ભીમડવારી તથા નંતીમાં કેટલાંક શેડ તણાઈ ગયા હતા. એક પુલને નુકશાન થયુ હતું. પોલીસ સ્ટેશનમાં પાણી ધુસ્યા હતા. બજારો ડુબી જતા ખાલી કરાવવામાં આવી હતી.

કુલ્થુની તીર્થન ઘાટીમાં પુરની હાલત વચ્ચે પાંચ કાર તથા ચાર કોલેજ તણાઈ ગયા હતા. લાહોલના મયાડમાં ૨૨ પરિવારોનુ સ્થળાંતર

ઈવીએમ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યુ હોય અને પરિણામ બદલાયું હોય તેવો પ્રથમ કિસ્સો

સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ મંગાવાયું, રિકાઉન્ટીંગ થતા ચૂંટણીનું પરિણામ જ બદલાઈ ગયું !

નવીદિલ્હી,તા.૧૪ ૨૦૨૨ના દિવસે સરપંચની ચૂંટણીના દેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે ખુદ પરિણામ બહેર કરવામાં આલ્યા હતા. કોર્ટ પરિસરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ જેમાં કુલદીપ સિંહ વિજેતા હતા. મોહિત મશીન (EVM) મંગાવીને કુમારે પરિણામને પડકારતા એડિશનલ હરિયાણાના પાનીપત જિલ્લાના નિવિલ જજ (સિનિયર ડિવિઝન) બુઆના લાખુ ગ્રામ પંચાયતના કમ ઇલેકશન ટ્રિબ્યુનલમાં અરજી સરપંચની ચૂંટણીની મતગણતરી દાખલ કરી હતી. ૨૨ એપ્રિલ ૨૦૨૨ના દિવસે, બદલાઈ ગયા અને મોહિત કુમારને ટ્રિબ્યુનલે બૂથ નંબર ૬૯ની ચૂંટાયેલા સરપંચ બહેર કરવામાં આપ્યો હતો. આપ્યા જણાવીદ્ધએકે, ૨ નવેમ્બર, જે ૭ મે ૨૦૨૨ના રોજ ડેપુટી

કમિશનર કમ ચૂંટણી અધિકારી દ્વારા કરવાનો હતો. ૧ જુલાઈ ૨૦૨૨ના દિવસે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશનો રદ કર્યો. ત્યાર બાદ, મોહિત કુમારે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ૩૧ જુલાઈ, ૨૦૨૨ના દિવસે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની બંડબંધી તમામ બૂથના માત્રાની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં ફેલાવામાં આવ્યું હતું કે, પાનીપતના ડેપુટી કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ ૬ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યે તમામ EVM સુપ્રીમ કોર્ટમાં લાવવા બોંધે અને કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા રિકાઉન્ટિંગ કરાવવામાં આવે. સમગ્ર ગણતરી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ગત ૬ ઓગસ્ટના દિવસે રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૭૬૭ મતોની ગણતરી કરવામાં આવી હતી. મોહિત કુમારને ૧૦૫૧ મત અને કુલદીપ સિંહને ૧૦૦૦ મત મળ્યા હતા. બાકીના મત અન્ય ઉમેદવારોને મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના OSD (રજિસ્ટ્રાર) કાવેરીએ ગણતરી કરી હતી અને રિપોર્ટ પર બંને પક્ષોએ સહી પણ કરી હતી.

KENVI JEWELS LIMITED					CIN : L52390GJ2013PLC075720
Address : Shop No. 121 & 122, Super Mall Complex, Nr. Lal Bungalow, CG Road, Ahmedabad, Gujarat, 380006					
Email id : compliance.kjl@gmail.com Tel. No. : 079-22973199 Web : www.kenvijewels.com					
STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2025					(Rs. in Lakhs)
Sr. No	Particulars	3 Months ended on 30-06-2025 Unaudited	3 Months ended on 31-03-2025 Audited	3 Months ended on 30-06-2024 Unaudited	Year ended on 31-03-2025 Audited
1	Total Income	3089.21	5525.61	2339.94	16195.44
2	Net Profit for the year before tax	24.71	22.73	20.9	97.1
3	Net Profit for the year after tax	18.71	14.06	15.9	75.43
4	Total Comprehensive Income for the year	18.71	14.06	15.9	75.43
5	Paid up Equity Share Capital (At par value of Rs 1/- each)	1002.56	1002.56	1002.56	1002.56
6	Other Equity Excluding Revaluation Reserve	-	-	-	-
7	Earnings per Share (Face Value of Rs.1/- each) Basic & Diluted	0.01	0.01	0.01	0.06
Notes : (a) The above financial result was reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 14.08.2025 (b) The Statutory Auditors have carried out Limited Review of the above standalone Unaudited financial results for the quarter ended on June 30th, 2025 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (d) The figures for the previous quarters/periods are re-arranged / re-grouped, wherever considered necessary.					
Place : Ahmedabad For and on behalf of Kenvi Jewels Limited					
Date : 14/08/2025 Sd/- Chirag Champaklal Valani, Managing Director - DIN : 06605257					

SAYAJI

SAYAJI INDUSTRIES LTD.

Regd. Office : P.O. Kathwada, Maize Products, Ahmedabad - 382430

Phone Nos. 079 22901581 to 85, E-mail : maize@sayajigroup.in

CIN:L99999GJ1941PLC000471

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE, 30 2025

The Board of Directors of the Company, at their Meeting held at August 14, 2025 approved the Unaudited Financial Results of the company, for the quarter ended June 30, 2025.

The results, along with the independent auditor's limited review report have been posted on the Company's Website at https://sayajigroup.in/pages/investors and can be accessed by scanning QR Code.

Note : The above intimation is accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

Place : Ahmedabad

Date : 14.08.2025

For and behalf of Directors

Of Sayaji Industries Limited

Sd/-

Vishnu H. Thaker

Company Secretary

(ACS-60441)

TRANS INDIA HOUSE IMPEX LTD

CIN: L74110GJ1987PLC152434


Reg. Off: B-1101, Titanium Square, B/h. Sarveshwar Tower, OPP. B. M. W. Show Room, Thalpet, Ahmedabad - 380 054, Gujarat, INDIA

E-mail: compliance@tihil.co.in, Website: www.tihil.co.in

EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER ENDED ON 30TH JUNE 2025

The Full format of the Unaudited Standalone Financial Results of the Company for the Quarter Ended on 30TH June 2025 are available on the Stock Exchange(s) Website (www.bseindia.in) and on the Company's website (www.tihil.co.in).

The same can be accessed by scanning the QR Code provided Below.



On behalf of Board of Directors


For Trans India House Impex Limited

Mayank Suresh Jolly

Whole Time Director

DIN:09366175

ATN INTERNATIONAL LIMITED				
CIN : L65993WB1983PLC080793				
Regd Office : 10, Princep Street, 2nd Floor, Kolkata - 700072				
Email : atninternationallimited@gmail.com, website : www.atninternational.in				
Phone No. 033-40022880, Fax : 91-33-22379053				
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS				
FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025				
(Rs. In Lacs)				
Sl. No.	Particulars	Quarter Ended 30.06.2025 (Unaudited)	Quarter Ended 31.03.2025 (Audited)	Quarter Ended 30.06.2024 (Unaudited)
1	Total Income from Operations	-	21.00	-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	(11.62)	7.39	(4.61)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	(11.62)	7.39	(4.61)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	(11.62)	7.39	(4.61)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	-
6	Equity Share Capital	1578.00	1578.00	1578.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs.4/- each) (for continuing and discontinued operations)	(0.03)	0.02	(0.01)
	1. Basic :	(0.03)	0.02	(0.01)
	2. Diluted :	(0.03)	0.02	(0.01)
Note :a) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchanges website i.e. www.nseindia.com, www.bseindia.com and www.cse-india.com and on the Company's website: www.atninternational.in.				
b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.				
c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules/AS Rules, whichever is applicable.				
By order of the Board For ATN INTERNATIONAL LIMITED Sd/- Santosh Kumar Jain, Managing Director DIN No. 00174235				
Place : Kolkata Date : 12th August, 2025				



बैंक ऑफ बड़ौदा

Bank of Baroda

Chhipwad Branch: House No - 8/1939, Opp. Govindji Temple, Chhipwad, Surat - 395 002

E-Mail: chhipw@bankofbaroda.com

NOTICE TO BORROWER (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)

To, Jodhani Maulik Kamleshbhai
Flat No 1304, F/2 Building, Rushikesh, Opp Zeel Park, Vraj Bhumi Township, Nana Varachha, Surat-395013

Mrs. Kanuben Bhagwanbhai Talaviya
Flat No 1304, F/2 Building, Rushikesh, Opp. Zeelpark, Nanavarachha, Vrajbhumi Township, Surat-395013

Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" A/c Mr. JODHANI MAULIK KAMLESHBHAI AND Mrs. KANUBEN BHAGWANBHAI TALAVIYA

Dear Sir/Madam

Re: Credit facilities with our Chhipwad Branch.


We refer to our Sanction letter no. 0000038370 LMS dated 30.12.2018 for your Housing Loan advance account Mr. MAULIK KAMLESHBHAI JODHANI and Mrs. KANUBEN BHAGWANBHAI TALAVIYA conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilizing the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:

Nature & type of Facility	Limit	Rates of Interest	O/s as on 30.07.2025 (Amount in Rs.) + Further Interest thereon + and Other Charges if any	Security agreement with brief description of securities
Housing Loan 0750060002 0968	Rs.25,00,000/-	9.00 % i.e. Net Interest Rate	Rs. 24,73,598.14 (Principal) + Rs. 19,439.69 (Unapplied interest +58,203.00 (Unserviced interest) + compound interest from 01.07.2025 to 30.07.2025 +penal interest @ 2% Simple)= Rs. 25,56,068.83/- + Further Interest thereon + and Other Charges if any.	All that right title and interest in the property bearing Flat No. 1304 admeasuring about 752 sq. fts. i.e. 69.89 sq.mts, on 13 th floor of "F-2" building "RUSHIKESH" together with undivided proportionate land admeasuring about 34.42 sq.mts. underneath the said building constructed on the land bearing Revenue Survey No. 50. i.e. Block No. 81 of village NANA VARACHHA Taluka Puna District Surat and Final Plot No.43 of Town Planning Scheme No.38 (Nana Varachha) Boundary Description East: Margin/other Society West: Stair/passage/lift North: Adj Flat No 1303 South: Internal Road / Parking In The Name Of Mcmaulik Kamleshbhai Jodhani & Mrs. Kanuben Bhagwanbhai Talaviya.
Baroda Personal Loan COVID 0750060002 1324	Rs.1.35,000/-	11.00% p.a	Rs. 25,681.78+ Rs. 258.89 Unapplied Interest + 608.00 Unserved interest + compound interest from 01.07.2025 to 30.07.2025 & Other Charges thereon + and Other Charges if any,i.e = 26,568.71 Further Interest thereon+	
Total	Rs.26.35,000.00		25,82,637.54 + Further Interest thereon	

Description of Securities:
All That Piece And Parcel Of The Immovable Property Bearing Property Bearing Survey No Rs No 50, Block No 81, To No 38, Fp No 43, Flat No 1304 Nanavarachha, Surat, Located At Plot No, Flat No 1304, Door No/house, Nearest Door-, Adm. Land Sq Feet, Build Up Area 1185, Which Is Situated At Rs No 50, B No 81, To No 38 Fp No 43, Flat No 1304, F/2 Building, Rushikesh, Opp zeel Park, Nanavarachha, Surat, Vrajbhumi Township, Municipality, City Surat City. District Surat.Boundary Description East: Margin/other Society,West: Stair/passage/lift,North: Adj Flat No 1301 ,south: Internat Road/parking in the name of Mr. MAULIK KAMLESHBHAI JODHANI & Mrs. KANUBEN BHAGWANBHAI TALAVIYA.

1. In the Document of Loan Agreement for Baroda Home Loan dated 31.12.2018, you have acknowledged your liability to the Bank to the tune of Rs. 25,00,000/- and Baroda Personal Loan COVID dated 07.12.2020 of Rs. 1,35,000/- respectively. The outstanding stated above include further drawings and interest upto 01.05.2025. Other charges debited to the account are Rs. Nil. 2. As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstanding for the quarter ended 30.06.2025. You have also defaulted in payment of installments of term loan/demand loans which have fallen due for payment on 01.07.2025 and thereafter. 3. Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 30.07.2025 (mention date of classification as NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon. 4. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 25,82,637.54 (Rupees Twenty Five Lacs Eighty Two Thousand Six Hundred Thirty Seven and Fifty Four paise Only.) / --+Interest & Other Charges thereon + and Other Charges if any, as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note. 5. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full. 6. We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act. 7. We further invite your attention to sub-section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any times before the date of publication of notice for public auction /inviting quotation / tender /private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available. 8. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

Date : 02.08.2025 | Place : Surat Authorized Officer, Bank of Baroda,Chhipwad Branch



बैंक ऑफ़ बड़ौदा

Bank of Baroda

Regional Office, 1st Floor, Mahalaxmi Towers, Tithal Road.

Dist. Bulsar - 396 001,Gujarat, India.. Ph.: 02632-241454,

Email: recovery.bulsar@bankofbaroda.co.in

Auction Sale Notice

For Gold Loan


NOTICE

The under mentioned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. Notices sent to them by Registered Post have been returned undelivered to the Bank. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before 27.08.2025 failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower at the Bank's premises at 12:00 P.M. to 04:00 P.M. on 28.08.2025 or on any other convenient date thereafter without further notice at the absolute discretion of the Bank.

Sr. No	Branch Name	Date of Loan	Loan Number	Name and address of the borrower
1	BULSAR MAIN,GUJARAT 9687680713	31-05-2024	02330600008223	Patel Pratixaben Manishbhai, Devcha Faliya Chharvada, Untdi, Valsad Gujarat - 396030
2	BULSAR MAIN,GUJARAT 9687680713	31-01-2023	02330600006595	Mohamedsalim Gulamali Mulla, Dr K C Patel Nana Taiwad, Valsad - 396001
3	DHARAMPUR, VALSAD 7776827584	14-05-2024	13490600006766	Ahir Dharmishabhen Rakeshbhai, 1371 Ahir Street Kanurbarda, Harampur, Valsad 396050
4	MOTI DAMAN, DAMAN & DIU 8469380142	14-03-2024	33530600001211	Anand Kumar Rai, Sun Sine Society A 4 A 306 Kopari Road, Chhiri Vapi 396191
5	RAKHOLI, SILVASSA 8605406562	28-09-2022	36730600001657	Divyaben Prabhubhai Patel, 220 School Faliya Samarvani Silvassa DNH Dadra And Nagar Haveli - 396230
6	ABRAMA BULSAR, GUJARAT 9687680702	18-01-2025	33000600005397	Dhaval Dharmendra Dubey, 540 Manek Nagar Orwad, Udwada Rs Tal Pardi 396185

Date : 14.08.2025 Place : Valsad

BRANCH MANAGER




TRANS INDIA HOUSE IMPEX LTD

CIN: L74110GJ1987PLC152434
Reg. Off: B-1101, Titanium Square, B/h. Sarveshwar Tower, OPP. B. M. W. Show Room, Thaltej, Ahmedabad - 380 054, Gujarat, INDIA
E-mail: compliance@tihil.co.in, Website: www.tihil.co.in

EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER ENDED ON 30TH JUNE 2025


The Full format of the Unaudited Standalone Financial Results of the Company for the Quarter Ended on 30th June 2025 are available on the Stock Exchange(s) Website (www.bseindia.com) and on the Company's website (www.tihil.co.in).

The same can be accessed by scanning the QR Code provided Below.



On behalf of Board of Directors
For Trans India House Impex Limited
Mayank Suresh Jolly
Whole Time Director
DIN:0936175

Place : Ahmedabad
Date : 13.08.2025



Head Office: HDFC Bank Ltd., HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013
Regional Office: HDFC Bank Ltd., Department For Special Operations, at 3 rd Floor, C-Wing, Sheetal West Park Imperia, Vastrapur Lake, Ahmedabad -380054.


E-AUCTION SALE NOTICE

PUBLIC NOTICE FOR E-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of immovable property mortgaged to Bank under Securitization and Reconstruction of Financial assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rule, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s)/Mortgagor(s)/Guarantor(s) that, the Authorized Officer(s) of HDFC BANK LTD. (the Bank) had taken physical possession of the following property mentioned, pursuant to demand raised vide notice(s) issued under Sec 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 in the following loan accounts with right to sell the same on "AS IS WHERE IS, AS IS WHAT IS, WHATEVER IS THERE IS AND WITHOUT RECOURSE BASIS" for realization of Bank's dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules proposes to realize the Bank's dues by sale of the said property/ies. The sale of the below-mentioned Properties shall be conducted by way of E-Auction through Web Portal: <https://www.bankauctions.com>.

Names of the Branch & Account	Name of the Mortgagor & Guarantor's of the Property	Details of Collateral Property	Reserve Price EMD Bid Increase Amount	Inspection Date and Time	Date / Time of E-Auction			
			Rs.1,10,00,000/- Rs. 11,00,000/- Rs. 1,00,000/-	30.08.2025 from 11.00 AM to 01.00 PM	19.09.2025 at 02.00 PM to 03.00 PM Last Date of Receipt of Bids alongwith EMD 13.09.2025 upto 4 PM			
HDFC Bank Ltd. Branch: Odhav branch A/c No. 50200034442676	Mortgagor: Mr. Maheshbhai Langnecha, Guarantor: Mr. Nareshbhai Langnecha	Industrial plot No. 627/3, admeasuring area 600.00 Sq.Mtrs. Of Survey No 113/P and 114/P of village Palej, Taluka and district Bharuch owned by Mr. Maheshbhai Langnecha. North: 20.00 Mt. Road, South: 16.00 Mt. Road, East: Plot No. 627/4, West: Plot No. 627/2.						
Amount as per Demand Notice / Demand Notice Date Rs. 1,04,28,167.21/- Demand Notice Dated: 24.02.2020			Name of Authorised Officer / Phone No. / Email id: Anil Sankhla / 09512999191 / anil.sankhla@hdfcbank.com					
TERMS & CONDITIONS: 1. The e-Auction is being held on "AS IS WHERE IS, AS IS WHAT IS, WHATEVER IS THERE IS AND WITHOUT RECOURSE BASIS" 2. The interested bidders shall submit their EMD details and documents through Web Portal: https://www.bankauctions.com (the user ID & Password can be obtained free of cost by registering name with https://www.bankauctions.com) through Login ID & Password. The EMD shall be payable EITHER through NEFT / RTGS in the following Account: 5750000904261, Name of the Account: DFSO Transitory account, Name of the Beneficiary: HDFC BANK LTD., IFSC Code: HDFC0000240. Please note that the Cheques / Demand Drafts shall not be accepted as EMD amount. 3. To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance i.e. statutory dues like property taxes, society dues etc as per Bank's record on the property other than the one leasehold rights created which is mentioned in detailed terms and conditions. The Bank however shall not be responsible for any present/past/future outstanding non-statutory dues/statutory dues/encumbrances/tax arrears/litigations, if any. The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property & to inspect & satisfy themselves. Property can be inspected strictly on the above mentioned date and time. 4. The intended bidders who have deposited the EMD and require assistance in creating Login ID & Password, uploading data, submitting bid, training on e-bidding process etc., may contact our service provider M/s. C1 India Pvt. Ltd., 3rd Floor, Plot No. 68, Sector 44, Gurgaon, Haryana-122003. Support Mobile Nos. : 7291981124/1125/1126, Mr. Bhavik Pandya - 0886682937. E-mail ID: support@bankauctions.com/gujarat@c1india.com. for any property related query may contact the Authorized officer as mentioned above in office hours during the working days. (10:00 AM to 5:00 PM). Hard copy of Tender Form be submitted along with Bid and EMD strictly on the above-mentioned date and time at above address of Authorised Officer. 5. If the Sale Price is more than Rs.50,00,000/- (Rupees Fifty Lakh Only) then the auction purchaser/successful bidder has to deduct 1% of the Sale Price as TDS in the name of the owner of the property & remit it to Income Tax Department as per section 194 I of Income Tax Act and only 99% of the Sale Price has to be remitted to the Bank. The Sale Certificate will be issued only on receipt of Form 26D8 & Challan for having remitted the TDS. 6. The highest bid shall be subject to approval of HDFC Bank Limited. Authorized Officer reserves the right to accept/ reject all or any of the offers/ bids so received, or cancel the auction/sale without assigning any reasons whatsoever. His decision shall be final & binding. 7. (FOR DETAILED TERM AND CONDITIONS PLEASE REFER TO OUR WEBSITE www.hdfcbank.com and www.bankauctions.com)								
STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002 This may also be treated as notice u/r 8(6) read with Rule 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to borrowers / and Guarantors of the above said loan about the holding of E-Auction Sale on the above mentioned date. The borrower/ guarantors / mortgagors are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before 30 days of this notice / the date of Auction, failing which the property will be auctioned / sold and balance dues, if any, will be recovered with interest and cost. Date : 14.08.2025, Place : Ahmedabad Sd/- Authorized Officer, HDFC Bank Ltd.								



SAYAJI INDUSTRIES LTD.

Regd. Office : P.O. Kathwada, Maize Products, Ahmedabad - 382430
Phone Nos. 079 22901581 to 85, E-mail : maize@sayajigroup.in
CIN:L99999GJ1941PLC000471

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE, 30 2025

The Board of Directors of the Company, at their Meeting held at August 14, 2025 approved the Unaudited Financial Results of the company, for the quarter ended June 30, 2025.


The results, along with the independent auditor's limited review report have been posted on the Company's Website at <https://sayajigroup.in/pages/investors> and can be accessed by scanning QR Code.

Note : The above intimation is accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

For and behalf of Directors
Of Sayaji Industries Limited
Sd/-
Vishnu H. Thaker
Company Secretary
(ACS-60441)

Place : Ahmedabad
Date : 14.08.2025

PATANJALI®		PATANJALI FOODS LIMITED					
CIN: L15140MH1986PLC038536		Regd. Office: 616, Tulsiani Chambers, Nariman Point, Mumbai - 400021					
Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the quarter ended 30 th June, 2025							
(Rs. in Lakhs)							
S. No.	Particulars	STANDALONE		CONSOLIDATED			
		Quarter Ended		Quarter Ended			
		30.06.2025 (Unaudited)	30.06.2024 (Audited)	30.06.2025 (Unaudited)	30.06.2024 (Audited)		
1	Total Income from Operations	8,89,970.53	7,17,716.79	34,15,696.73	8,89,970.53		
2	Net Profit/(Loss) (before Tax, Exceptional and/or Extraordinary items)	24,859.75	35,915.47	1,72,616.43	24,859.75		
3	Net Profit/(Loss) before tax (after Exceptional and/or Extraordinary items)	24,859.75	35,915.47	1,72,616.43	24,859.75		
4	Net Profit/(Loss) after tax (after Exceptional and/or Extraordinary items)	18,039.14	26,290.15	1,30,134.16	18,039.14		
5	Total Comprehensive Income [Comprising Profit/(Loss) (after tax) and Other Comprehensive Income (after tax)]	18,039.14	26,290.15	1,30,134.16	18,039.14		
6	Equity Share Capital	18,039.14	26,290.15	1,30,134.16	18,039.14		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	11,29,910.39	-		
8a	Earnings Per Share (of Rs. 2/- each) (before extraordinary and exceptional items)*Not annualised	-	-	11,29,910.39	-		
	1. Basic :	4.98*	7.26*	35.96	4.98*		
	2. Diluted :	4.98*	7.26*	35.96	4.98*		
8b	Earnings Per Share (of Rs. 2/- each) (after extraordinary and exceptional items)*Not annualised	-	-	11,29,910.39	-		
	1. Basic :	4.98*	7.26*	35.96	4.98*		
	2. Diluted :	4.98*	7.26*	35.96	4.98*		
Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company- www.patanjalifoods.com and on the Stock Exchange websites www.bseindia.com , www.nseindia.com and www.cseindia.com .							
By order of the Board For AND ON BEHALF OF THE BOARD OF DIRECTORS Managing Director							
Place : Hariwar Date: August 14, 2025							



HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED


Registered Office: 'HOEC House', Tandajia Road, Off Old Padra Road, Vadodara-390 020.
Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Extract of Standalone and Consolidated Financial Results (Unaudited) for the Quarter ended June 30, 2025

(₹ in Lacs except per share data)

S. No.	Particulars	Standalone		Consolidated	
		For the Quarter ended		For the Quarter ended	
		30 June 2025	31 March 2025	30 June 2025	31 March 2025
		Unaudited	Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operations	8,197.54	17,901.90	8,371.91	38,498.00
2	Net Profit for the period (before tax and exceptional items)	1,569.26	13,100.85	1,262.64	14,847.33
3	Net Profit for the period before tax (after exceptional items)	4,821.13	13,100.85	1,262.64	14,847.33
4	Net Profit for the period after tax (after Exceptional items)	4,821.13	13,000.81	1,218.28	14,747.29
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,811.61	12,988.97	1,209.86	14,709.19
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93
7	Reserves	-	-	1,02,712.67	-
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized)	-	-	-	-
	Basic EPS ₹	₹ 3.65	₹ 9.83	₹ 0.92	₹ 11.15
	Diluted EPS ₹	₹ 3.65	₹ 9.83	₹ 0.92	₹ 11.15

The above is an extract of detailed format of Quarterly financial results filed with the Stock Exchanges under regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results is available on the Stock Exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com.



BY ORDER OF THE BOARD
For Hindustan Oil Exploration Company Limited

R.Jeevanand